

આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે વિશ્વ વ્યાપાર સંગઠન (WTO) અને ઝાયડસ કેડીલા હેલ્થકેર તથા ગુલબ્રાન્ડસન કેમીકલ્સ પ્રા. લિમિટેડના સહયોગથી ખેડૂતની આવક વધારવામાં પશુપાલનના યોગદાન અંગે એક-દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો

ખેતી સાથે પશુપાલન એક પૂરક વ્યવસાય તરીકે સ્વીકારી પોતાના નાના-નાના ટુકડાઓમાં વહેચાયેલ જમીનમાંથી ઉત્પાદિત અનાજ તથા ઘાસચારા દ્વારા લગભગ ૬૦ થી ૭૦ ટકા ગ્રામ્ય કુટુંબો પોતાનું જીવન ગુજારે છે. પશુપાલન ના વ્યવસાયથી બહેનો રોજ-બરોજના ખર્ચા આનાથી મેળવી સારી રીતે જીવન ચલાવી શકે છે. તેના બદલે ખેતી સાથેના પશુપાલનના વ્યવસાયને વૈજ્ઞાનિક ઢબે અપનાવી બહેનો પણ પુરુષો સાથે કુટુંબને સહાયક બનવામાં મદદરૂપ બને તે સમયની માંગ છે. તેથી કૃષિ અર્થશાસ્ત્ર વિભાગ, બં. અ. કૃષિ મહાવિદ્યાલય ખાતે તા.૨૨/૧૧/૨૦૧૯ શુક્રવારના રોજ વિશ્વ વ્યાપાર સંગઠન (WTO) સેલ તેમજ ઝાયડસ કેડીલા હેલ્થકેર લિમિટેડ ગ્રુપ, ડભાસા તથા ગુલબ્રાન્ડસન કેમીકલ્સ પ્રા. લિમિટેડ, મુજપુરના સહયોગથી પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલ બહેનો માટે એક દિવસીય તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું.

તાલીમ કાર્યક્રમના ઉદઘાટક રચના બંસલ દ્વારા પશુપાલન તાલીમની ઉપયોગીતા વિષેની માહિતી આપવામાં આવી તથા ડૉ. કે. એસ. જાદવ, વિભાગીય વડા દ્વારા તાલીમનું મહત્વ અને તેના દ્વારા થતા ફાયદાઓની જાણકારી આપી તથા ડૉ. વી. કે. ગોંડલિયા દ્વારા WTO સેલ અંતર્ગત યોજવામાં આવતા વિવિધ તાલીમ કાર્યક્રમ અંગેની જાણકારી સાથે વિભાગની અન્ય પ્રવૃત્તિઓનું વર્ણન કર્યું.

તાલીમમાં વેટરનરી કોલેજના વિવિધ વિભાગોના તજજ્ઞો દ્વારા વિભિન્ન વિષયો ઉપર વ્યાખ્યાન આપવામાં આવ્યા. જેમાં ડૉ. આર. એમ. રાજપુરા, પશુ વિજ્ઞાન વિભાગ દ્વારા ગુજરાતની ગાય-ભેંસોની ઓલાદ શારીરીક અને આર્થિક લક્ષણો, મુખ્ય ઘાસચારા વિભાગના મદદનીશ પ્રાધ્યાપક ડૉ. હિરેન પટેલ, દ્વારા ઘાસચારા પાકોની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ, ડૉ. ડી. સી. પટેલ દ્વારા વિવિધ સંવર્ગની ગાય-ભેંસો માટે પશુ આહાર અને પશુપોષણ વ્યવસ્થા, ડૉ. એ. જે. ધામી પ્રાધ્યાપક અને વડા ગાયનેકોલોજી વિભાગ દ્વારા ગાય ભેંસોમાં ગર્ભધારણ અને વંધ્યત્વના પ્રશ્નો અને ઉકેલ, ડૉ. જી. સી. મંડલી દ્વારા પશુઓના સામાન્ય રોગો, ઉપચાર અને અટકાયતી ઉપાયો તથા કૃષિ અર્થશાસ્ત્ર વિભાગના મદદનીશ પ્રાધ્યાપક રચના બંસલ દ્વારા દૂધ ઉત્પાદનનું અર્થકરણ તથા આદર્શ પશુપાલનમાં ફાર્મ રેકર્ડ અંગેની સમજ આપી. થીયરી સાથે પ્રેક્ટીકલ જ્ઞાન મળી રહે તે હેતુથી શ્રી સંજયભાઈ રબારી વડોદ-ગોપાલપુરા રોડ ખાતેના તબેલાની મુલાકાત લીધી. તેમને ત્યાં ૩૦ ગાય ૦૫ ભેંસ ૦૮ નાના વાછરડાંનો ખૂબ સુંદર આયોજન સાથેનો તબેલો બનાવેલ છે. તેમણે શરૂઆતથી અત્યાર સુધી કેવી રીતે તબેલાનો વિકાસ થયો તેનું સુંદર નિરૂપણ કર્યું અને જણાવ્યું કે પશુપાલન એજ આજના સમયમાં ખેડૂતોનો આર્થિક રીતે પોષણક્ષમ વ્યવસાય છે. સદર તાલીમ કાર્યક્રમમાં ઝાયડસ કેડીલા હેલ્થકેર લિમિટેડ ગ્રુપ, ડભાસાના શ્રી પ્રકાશભાઈ તથા ગુલબ્રાન્ડસન કેમીકલ્સ પ્રા. લિમિટેડ, મુજપુરના શ્રી કિરણભાઈ ગોહિલ દ્વારા ખૂબ જહેમત કરી ઉત્સાહી અને પશુપાલન વ્યવસાયમાં કાર્યરત બહેનોને લાવ્યા તે બદલ પ્રો. રચના બંસલે તેમનો ખૂબખૂબ આભાર માન્યો.

